



ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન



પદ્ધિન દિનદ્યાળ ઉપાધ્યામ ભવન
દ્વારા સ્ટેશન પાદ્થળ, રોડસ્ટ-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૬
ફોન નંબર-૦૭૯૮ ૨૩૨ ૨૦૪૪૦, ફોન નંબર-
૦૭૯૮ ૨૩૨ ૨૧૪૯૮

Email:gmc8gandhinagar@gmail.com

એક જીવન
એક ભૂષણ
એક બૃદ્ધિ
એક પુત્રિઓ
ONE EARTH • ONE FAMILY • ONE FUTURE

તા.૧૨/૦૪/૨૦૨૩

ક્રમાંક: ગા.મ.ન.પા./સંકલન/ક્ર.ન.-૧૬/૨૦૧૭/ ૧૨૦૨૩

વિષય:- માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ની કલમ-(૪)(ખ) હેઠળ જાહેર કરવાનું થતું

પ્રોએક્ટીવ ડિસ્કલોઝર(PAD) અધિતન કરવા બાબત.

સંદર્ભ:- (૧) ગુજરાત સરકાર, સામાન્ય વહીવટ વિભાગ, પરિપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૩-
૩૩૪૩૬૪-આરટીઆઇસેલ, સચિવાલય, ગાંધીનગર, તા..-૦૧-૦૫-૨૦૦૬.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, સંદર્ભદર્શિત પરિપત્ર અનુસાર સચિવાલયના વિભાગો, તેમના નિયંત્રણો હેઠળના ખાતાના વડા અને બોડી/કોર્પોરેશન તથા સર્વે જાહેર સત્તામંડળોએ પ્રોએક્ટીવ ડિસ્કલોઝર (PAD) તૈયાર કરીને પુસ્તિકા સ્વરૂપે પ્રસિદ્ધ કરીને વિભાગની વેબસાઇટ ઉપર તથા નાગરિકોને સરળતાથી મળી રહે તે રીતે ઉપલબ્ધ કરાવવાની રહે છે. આથી સંદર્ભદર્શિત પત્ર અન્વયે તૈયાર કરવાના સરણીયાં પ્રોએક્ટીવ ડિસ્કલોઝર(PAD) માટે <https://rti.gov.in/rti-act-2005-gujarati.pdf> લિંક પરના પાના નં.૩૮ થી ૬૨માં દર્શાવેલા મુદ્દાની માહિતી અતેની સંકલન શાખાને તા.૩૦-૦૫-૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

બિડાણા:- ઉદાહરણ દર્શાવતું પત્રક.

(કેયુર પી. જેઠાલા),
નાયબ મ્યુનિસિપલ કમિશનર,
ગાંધીનગર મહાનગરપાલિકા,

ગાંધીનગર
૦૧૮૮૫૧૨૩ મુજબ
૨૫/૦૫/૨૩

પ્રતિ,
તમામ શાખાધિકારીશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર તરફે અમલવારી કરવા સાંકે.

નકલ સહિતના રવાના:-
માન. કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર તરફે જાણ સાંકે.

રાઇટ ટુ ઇન્જીનીઝિનિયરિંગ એક્ટ ૨૦૦૫ સંદર્ભે તથા હક્કમ ૧૦૦૮/૦૫-૦૬ સંદર્ભે કલમ

૪-૧(ખ) અન્વયે ખાતાની હાલ સુધીની માહિતી બાબત.

જન્મ-મરણ અને લગ્ન શાખા, ગાંધીનગર મહાનગરપાલિકા

(૧) સંસ્થાની કામગીરીઓ અને ફરજોની વિગત:

- સબ રજીસ્ટ્રાર, જુનિયર ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, વગેરે કર્મચારીઓને નિયત કામગીરી સોપવી તથા તેઓ પોતાની ફરજો યોગ્ય અને ન્યાયી રીતે બજાવે તે પ્રમાણે સુપરવિઝન કરવું.
- જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો બજાવી સમય મર્યાદામાં માહિતી પૂર્ણ પાડવાની કામગીરી.
- હાઇકોર્ટ માં દાખલ કરેલ સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન અન્વયે સોગંદનામું કરીને મુદત સમયે હાઇકોર્ટ માં હાજર રહેવું.
- લગ્ન નોંધણી ની પ્રક્રિયા માં દસ્તાવેજુ પુરાવાઓની ચકાસણી કરીને લગ્ન પ્રમાણપત્ર સહી કરવી.
- જન્મ-મરણ અને લગ્ન નોંધણી અંગેની કાર્યપદ્ધતિ અથવા તે અંગે અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તે અંગેની ફરિયાદ નિવારણ ની કામગીરી કરવી.

(૨) પોતાના અધિકારી અને કર્મચારીઓની સત્તાઓ તથા ફરજો:

ગાંધીનગર મહાનગરપાલિકાના સંકલન શાખાના અધિકારી/કર્મચારીઓના નામ, હોક્કો, પગાર તથા કામગીરીની વિગત.

અ.નં	નામ	હોક્કો તથા પગારની વિગત	કામની વિગત
૦૧	ડૉ.કે.આઈ.ગોસ્વામી મો.નં-૮૭૨૭૭૪૨૨૩૭ E-mail-medoff-gmc- gnr@gujarat.gov.in	રજીસ્ટ્રાર રજીસ્ટ્રાર	ઉપરના મુદ્દા નં. ૦૧ મુજબ

02	જ.બી.પંચાલ મો.નં. 9428735612 E-mail-subregi-gmc-gnr@gujarat.gov.in	સબ-રજીસ્ટ્રાર	ઉપરના મુદ્દા નં. ૦૧ મુજબ તેમજ શાખાધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ અન્ય કામગીરી
03	યશપાલસિંહ રાજપુત મો.નં.-૮૧૬૦૫૩૪૭૦૦ E-mail-subregi-gmc-gnr@gujarat.gov.in	જ.કલાક	ઉપરના મુદ્દા નં. ૦૧ મુજબ તેમજ શાખાધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ અન્ય કામગીરી
04	શૈલેન્જસિંહ બિહોલા મો.નં.-૮૫૧૧૯૯૦૧૬૬ E-mail-subregi-gmc-gnr@gujarat.gov.in	જ.કલાક	ઉપરના મુદ્દા નં. ૦૧ મુજબ તેમજ શાખાધિકારીશ્રી દ્વારા સોંપવામાં આવેલ અન્ય કામગીરી

૩) નિરિક્ષણ અને જવાબદારીના સાધનો સહિત નિર્ણય લેવાની પ્રક્રિયા :

- સક્ષમ મંજુરી મેળવતી વખતે મુખ્યત્વે નીચે પુમાણે કાર્યપદ્ધતિ હાથ ધરવામાં આવે છે. સંબંધિત સ્ટાફ દ્વારા કચેરીના સબ-રજીસ્ટ્રારશ્રીને નોંધસહની ફાઇલ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ, રજૂ થયેલ સક્ષમ નિર્ણય અર્થેની ફાઇલ જરૂરી હકીકત સહ રજીસ્ટ્રારશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. જે કિસ્સામાં અંતિમ સત્તાધિકારી ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી હોય ત્યાં મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત નિર્ણય કરવાની સત્તા સ્થાયી સમિતિ/સામાન્ય સભા પાસે હોય તો સ્થાયી સમિતિ/સામાન્ય સભા તરફે રજૂ કરવામાં આવે છે.

૪) પોતાના કાચો બજાવવા માટે નક્કી કરાયેલા ધોરણો :

-વિભાગમાં રોજ-બરોજના કાચો પાર પાડવા કરવા માટે જી.પી.એમ.સી. એકટની જોગવાઇઓ, નિયમો તથા અત્રેની કચેરી દ્વારા સમય-સમયે જારી કરેલ પરીપત્રો અનુસાર કાચો કરવાના રહે છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા સમયે સમયે બહાર પાડવામાં આવતી મૌખિક/લેખિત સૂચનાઓ આદેશોનું અમલીકરણ રોજિંદી ફરજો બજાવવા અર્થે કરવાનું રહે છે.

૫) પોતાના કાચો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો સૂચનાઓ નિયમ સંગ્રહો અને રેકૉર્ડ :

-વિભાગની મુખ્યત્વે કામગીરીમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સક્ષમ અધિકારી તથા પદાધિકારી દ્વારા કરવામાં આવેલ પરિપત્રો, ઠરાવો વિગેરે ધ્યાને લેવાના રહે છે.

૬) પોતાના દ્વારા અથવા અંકુશ હેઠળ રખાયેલ વિવિધ કેટેગરીના દસ્તાવેજોનું નિવેદન :

-ખાતાને લગતી માહિતીઓનો રેકૉર્ડ ફાઇલ સ્વરૂપે, રજિસ્ટર સ્વરૂપે નિભાવણી કરવામાં આવે છે.

૭) તેની નીતિ ઘડવાના અથવા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા રજૂઆત કરાયેલી અથવા તેની ચર્ચા માટે રહેલી કોઇપણ પ્રકારની વ્યવસ્થાની વિગતો :

-ખાતા માટે નીતિ ઘડવાના તથા તેના અમલીકરણ સંબંધિત જાહેર જનતાના સભ્યો દ્વારા જો કોઇ રજૂઆત કરાયેલી હોય તે તેઓ કચેરી સમય દરમયાન સંકલન શાખામાં ચર્ચા માટે કોઇ પણ દિવસે આવી શકે છે.

૮) પોતાના ચલણના હેતુ માટે અથવા તેના ભાગ તરીકે રચાયેલી બે કે તેથી વધુ વ્યક્તિઓ ધરાવતાં, બોર્ડસ કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોનું નિવેદન અને બોર્ડસ કાઉન્સિલ કમિટીઓ અને અન્ય મંડળોની બેઠકો જાહેર પ્રજા માટે ખુલ્લી છે કે કેમ ? અથવા આવી બેઠકની વિગતો જાહેર પ્રજા મેળવી શકે કે કેમ ?

-અત્રેની શાખાને(જન્મ-મરણ અને લગ્ન શાખાને) લાગુ પડતું નથી.

૯) પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની ડિરેક્ટરી :

-મુદ્દા નં. ૨માં સમાયેલ યાદી મુજબ

૧૦) તેના નિયમમાં પુરી પડાયેલ પડતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલ માસિક પગાર:

-માસિક પગાર અંગેની વિગત મુદ્રા નં. ૨ના લિસ્ટમાં આવરી લેવામાં આવેલ છે.

૧૧) તમામ યોજનાઓની વિગતો, સૂચિત ખર્ચાઓ અને કરાયેલ ચૂકવણીના અહેવાલો દર્શાવતા તેની તમામ એજન્સીને ફાળવેલ બજેટ :

-અતેની શાખાને(જન્મ-મરણ અને લઘુ શાખાને) લાગુ પડતું નથી.

૧૨) ફાળવાયેલી રકમ અને આ કાર્યક્રમોથી ફાયદો મેળવનારની વિગતો સહિત સબક્સિડી સહિત કાર્યક્રમોનો અમલનો પ્રકાર:

-લાભાર્થીઓને લગતી માહિતી હોય, અતેની કચેરીને લાગુ પડતું નથી.

૧૩) તેના દ્વારા અપાયેલી છૂટછાટો, પરવાનગીઓ અને સત્તા સૌંપણી મેળવનારની વિગતો :

-અતેની શાખાને(જન્મ-મરણ અને લઘુ શાખાને) લાગુ પડતું નથી.

૧૪) ઇલેક્ટ્રોનિક્સ ફોર્મ્સમાં ઘડાયેલી તેના દ્વારા રાખયેલી અથવા તેને ઉપલબ્ધ માહિતીના સંદર્ભની વિગતો :

-અતેની શાખામાં જન્મ-મરણના જુના રેકર્ડ સ્કેન કરીને પી.ડી.એફ બનાવેલ છે તથા વર્ષ ૨૦૧૮થી ઓનલાઈન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરેલ છે.

૧૫) પુસ્તકાલય અથવા વાંચનખંડના કામના કલાકો સહિત માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો, જો જાહેર ઉપયોગ માટે તેની જાળવણી કરાઇ હોય તો :

-અતેની શાખામાં પુસ્તકાલય કે વાંચનખંડ ઉપલબ્ધ નથી.


૧૬) જાહેર માહિતી/અપીલ અધિકારીના હોક્કો અને અન્ય વિગતો

મદદનીશ જાહેર માહિતી અધિકારી	જાહેર માહિતી અધિકારી	અપીલ અધિકારી
સબ રજીસ્ટ્રાર	રજીસ્ટ્રાર	નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા

૧૭) જન્મ-મરણ અને લગ્ન શાખાનું સને ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર:

- અતેની કચેરીની (જન્મ-મરણ અને લગ્ન શાખાને) લાગુ પડતું નથી.

૧૭) જન્મ-મરણ અને લગ્ન શાખાનું વહીવટી માળખું:



રજીસ્ટ્રાર

જન્મ-મરણ અને લગ્ન નોંધણી
ગાંધીનગર મહાનગરપાલિકા,
ગાંધીનગર